

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટને ઇન્ટરિમ ચીફ એડમિનિસ્ટ્રેશન ઓફિસર (CAO) ની નિમણૂક કરી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ફેબ્રુઆરી 11, 2022) – પોતાની ફેબ્રુઆરી 11 નાં રોજ મળેલી બેઠકમાં, સીટી કાઉન્સિલે નિર્ધારિત કર્યું કે આ સંસ્થા COVID-19 માંથી સમુદાયની રિકવરીને ટેકો આપવા તરફ પોતાના આગળના પગલાઓ ભરે છે અને વધારે મજબૂત, વધારે ટકાઉ ભાવિ માટેનો પાયો નાખે છે ત્યારે, કાઉન્સિલે સર્વસંમતિથી પૉલ મોરિસન (Paul Morrison) ની નિમણૂક ઇન્ટરિમ (વચગાળાના) CAO તરીકે કરી. આ ભૂમિકાને વહેલામાં વહેલી તકે કાયમી ધોરણે ભરવાની યોજના પર કામ ચાલુ છે.

પૉલે સીટીમાં બાય-લૉ ઍન્ડ એન્ફોર્સમેન્ટના ડાઈરેક્ટર તરીકે અને કાર્યકારી લેજિસ્લેટિવ સર્વિસીસ કમિશનર તરીકે અગ્રણી ભૂમિકાઓ ભજવી છે, અને તેઓ હેમિલ્ટન પોલીસ સર્વિસમાં ભૂતપૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ હતા. COVID-19 નાં આ પડકારભર્યા સમયગાળા દરમિયાન બાય-લૉ ટીમની આગેવાની કરવામાં પૉલનો હાથ સતત રહ્યો છે.

ડેવિડ બારિક (David Barrick) નવી તકો અજમાવવા આગળ વધે છે ત્યારે આપણી કાઉન્સિલ મહામારી સામે સીટીની પ્રતિક્રિયાની આગેવાની કરવામાં તેમના અથાક પ્રયત્નો ઉપરાંત, મૅક્લીન્સ (Macleans) દ્વારા 2021 માટે કેનેડાના શ્રેષ્ઠ સમુદાયો પૈકી એક તરીકે, અને વર્ષ 2021 માં કેનેડાના શ્રેષ્ઠ એમ્પ્લોયર્સમાંના એક તરીકે તાજેતરમાં મળેલા રેકિંગ (ક્રમાંકન) સહિત, આપણી સંસ્થા અને સમુદાયને આપેલા ફાળા બદલ, તેમનો આભાર માનીને તેમની સેવાને સ્વીકારે છે.

સીટી ઓફ બ્રેમ્પટન સમુદાય માટે સૌથી મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખીને, કાઉન્સિલની અગ્રતાઓના આ સમયગાળામાં મહત્વનું કામ ચાલુ રાખવા આશાવાદી છે.

અવતરણો (ક્વૉટ્સ):

“મેં રજૂ કરેલા અને સમગ્ર કાઉન્સિલે સમર્થન આપેલા પ્રસ્તાવમાં, અમે COVID-19 અને આપણી આર્થિક રિકવરીમાં સીટી ઓફ બ્રેમ્પટનનું સંચાલન કરવા પૉલ મોરિસન (Paul Morrison) ને સર્વાનુમતે પસંદ કર્યા છે. તેમનો વૈધાનિક (લેજિસ્લેટિવ) સેવાઓ, બાય-લૉ અને એન્ફોર્સમેન્ટ (કાયદાકીય અમલબજાવણી), અને પોલીસ કામગીરીમાં અનુભવ તેમને આપણી કાઉન્સિલના ઇન્ટરિમ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર બનવા અજોડપણે લાયક બનાવે છે. પૉલમાં અમારો સંપૂર્ણ આત્મવિશ્વાસ છે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca